



RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHR CHIMANBHAI PATEL VIRAS BHAVAN, POST BOX NO 238, JAMNAGAR ROAD, RAJKOT

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટીફિકેટ/પુ.વિ.ચો/૨૦૩૧/૬૭૫૨

તા.૩૧-૦૧-૨૦૨૦

પ્રતિ

શ્રી મોહીત હેમરાજભાઈ કાયા

ગાયત્રીનગર મેઇન રોડ,

C/o. નિરવ એસ. વડુ (કન્સલ્ટીંગ સીવીલ એન્જીનીયર)

રેયા, રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૨૯-૦૧-૨૦૨૦ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- મવડી તાલુકો- રાજકોટ ના રેવન્યુ સર્વે નં.- ૨૫૫ / ૨૫૬ પૈકી અંતિમ ખંડ નં.- --- પ્લોટ નં.- ૮/૧ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ રહેણાંક ઝોનમાં સુચિત કરાયેલ છે.

સદરહુ જમીન મોજે - મવડી ની ટી.પી. સ્કીમ નં.- ૨૬ ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/ખાંધકામની પરવાનગી નથી.

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

A.D.P. રાજકોટ


RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY-RUDA



PART PLAN
OF

SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act, 1976)
Vide U.D. & U.H. Department Notification No.GH/V/192 of 2016 /DVP-13-2016-223702-L, Dated 27-10-2016.
Sanctioned Variation in the Second Revised Development Plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)
under Government Notification of Urban Development & Urban Housing Department
No.GH/V/236 of 2017 /DVP-132017-726-L, Dated 13-10-2017 & R's Corrigendum No.GH/V/236 of 2017 /DVP-132017-726-L, Dated 24-10-2017.



In case of Any Errors/Disputes The Record At Ruda Office Shall Be Considered Official & Shall Be Final & Binding to All.
NOTE : This Part Plan can not be used for making any entry in revenue records and can not be Considered as Development Permission for Addition/Alteration.

ISSUED ONLY FOR

SURVEY NO.: 255,256
VILLAGE : MAVDI
TALUKA : RAJKOT
T.P.S. NO. : 26
F.P. NO. : _____

Prepared By : A.D.P.
Checked By : [Signature]
DATE : 31-JAN-2020

LEGEND

- Residential Zone
- Existing Road
- Proposed Road
- TPS Boundary
- RMC Boundary
- Village Boundary



SCALE = 1 CM. = 80 MT.

TRUE COPY

[Signature]
JUNIOR TOWN PLANNER
RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY
RAJKOT